




બહાર જઇને કંઇક કરો

આ દુનિયા રોમાંચક શબ્દો અને ચિત્રો તેમજ કરવા લાયક, અનુભવવા અને શોધવા લાયક બાબતોથી ભરપૂર છે, અનાજના પેકેટ્સ અને સ્ટરીટ ચિહ્નોથી માંડીને છબ્બિયા કરાવતા ખાબોચિયા અને સ્ખલિત પાંદડાઓ.

તમારા બાળકને પોતાની આસપાસની દુનિયા ખોળવા પરોત્સાહિત કરો.

- ચાલવા જાવ અને સ્ટરીટ ચિહ્નો અને સ્ટોરફ્રન્ટ પરના અક્ષરો, શબ્દો અને સંખ્યાઓ વિશે વાત કરો
- ખાદ્યપદાર્થોની ખરીદી કરતી વખતે, ફળો અને શાકભાજીનો આકાર, રંગો અને સુગંધની સરખામણી કરો

શું તમને ખબર છે કે ચાલવા માટે બહાર જવાથી તમારા બાળકને શીખવામાં મદદ મળે છે. તમારા બાળકની ગતિએ ચાલો, વાતચીત કરો અને બાળકે જોયેલી બાબતમાં રસ લો અને તેના વિશે પૂછો.



કેવી રીતે પિક્ચર કાર્ડ્સ કી રિંગ બનાવવી અને તેનો ઉપયોગ કરવો

તમને શેની જરૂર પડશે

- તમારી ખરીદવાની યાદી બનાવવા પેન્સિલ અને કાગળ
- ફળ અને શાકભાજીના ચિત્રો
- બાળક માટે સલામત કાતર
- કાણું પાડતું પંચ
- ચિત્રોમાંથી દોરો પરોવવા દોરી કે રિબન

તમારે શું કરવાનું છે

એક રેસિપી શોધો અને સાથે મળીને પતિરકાઓ અને સામયિકોમાંથી ઘટકોના ચિત્રો કાપીને ખરીદવાની યાદી બનાવો.

દરેક ચિત્રના ખૂણામાં કાણું પાડીને કી રિંગ બનાવો અને તેને દોરી સાથે બાંધી દો.

તમે ખરીદી કરવા જાવ ત્યારે તમારા બાળકને કી રિંગનો ઉપયોગ કરવા દો. તેનાથી તેણીને ચિત્રોનો ઉપયોગ કરીને ખાદ્યપદાર્થ શોધવામાં મદદ મળશે. તમે જુઓ તે વિશે વાત કરો અને તમને કેટલી સંખ્યાની જરૂર છે, સાથે મળીને તેની ગણતરી કરો.

સ્ટાર ટિપ

પિક્ચર કાર્ડ્સ કી રિંગ્સ તમારા બાળક સાથે રમવાની એક સરસ રીત છે. તમે બહાર જઇને કંઇક કરવાના હો ત્યારે તમારા જોવામાં આવે તેવા ચિત્રોની કી રિંગ્સ બનાવવાનો પર્યતન કરો.

નાની વાતચીત માટે મૌલિક વિચાર

તમે તમારા બાળક સાથે બહાર જઇને કંઇક કરવાના હો ત્યારે, ટ્રાફિકનો ઘોંઘાટ, સાઇરનસ, સંગીત, ફૂતરાનું ભસવું, પક્ષીઓનું ગાવું અને આકાશમાં ઉડતા વિમાનો સહિત, તમે સાંભળી શકો તે અવાજ સાંભળો. તમે સાંભળ્યું હોય તે વિશે વાત કરો. અવાજોની નકલ કરવાનો પર્યતન કરો — શું તમે સરખો અવાજ કાઢી શકો છો?